



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૯/૦૮/૨૦૧૯ શુક્રવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૩૩૯/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૬ કેસ કરી, ૩૨ વ્યક્તિઓને ઝડપી, ૧૨૧ લીટર દેશી દારૂ, ૩૦૬ બોટલ ઈંગ્લીશ દારૂ અને ૧ સ્કુટર કબજે કર્યું હતું. તેમજ જુગારધારા હેઠળ ૬ કેસ કરી, ૩૦ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૬૧,૪૦૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૩૪૦/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૨૯ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી.૯૩ મુજબ ૩ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ઘરફોડ :-

સમાચાર યાદી નં.૧૩૪૧/૧૯

**સોલા હાઈકોર્ટ:** ઇશ્વરભાઈ ધોલતરામ વનીધાની (રહે. રંગ ઉપવન બંગ્લોઝ સાગર ફ્લેટ પાસે આર.સી.ટેકનીકલ રોડ ઘાટલોડીયા) એ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૭/૦૮/૧૯ સાજના ૬/૦૦ થી તા.૦૮/૦૮/૧૯ સવારના ૭/૦૦ વાગ્યા દરમિયાન ગોતા બ્રીજ નીચે આવેલ ગુજરાત ટિમ્બર માર્ટની સામે આવેલ વી.કે.એસ્ટેટ નામની પોતાની ઓફીસનું શરત તોડી અજાણી વ્યક્તિ ઓફીસમાં પ્રવેશ કરી તિજોરીનું તાળુ ખોલી ડેલ કંપનીનું લેપટોપ કિંમત રૂપિયા ૩૫,૦૦૦/-, એલ.જી.ટીવી કિંમત રૂપિયા ૧૦,૦૦૦/-, ડી.વી.આર રેકોર્ડર કિંમત રૂપિયા ૧૦,૦૦૦/- રોકડ રૂપિયા ૭૫,૦૦૦/- તેમજ જરૂરી દસ્તાવેજની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી જે.ડી.પટેલ ચલાવે છે.

લુંટની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૩૪૨/૧૯

**કાગડાપીઠ:** રામનરેશસિંગ શ્રીપતિરાખનસિંગ ક્ષત્રિય (ઉ.વ.૫૨) (રહે. પરીષ્કાબર એપાર્ટમેન્ટ ખોખરા સર્કલ) તા. ૦૭/૦૮/૧૯ રાતના ૧૦/૦૦ વાગ્યાના સુમારે કાંકરીયા રેલ્વે યાર્ડ પાસે ગેરેજ નજીકથી સ્કુટર ચલાવી પુત્ર રાહુલસિંગ સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ ત્રણ પુરૂષોએ રામનરેશસિંગ ક્ષત્રિયના સ્કુટરને ટક્કર મારી નીચે પાડી ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી આપી રામનરેશસિંગ ક્ષત્રિય પુત્ર રાહુલસિંગને હાથે કલાઈના ભાગે બચકા ભરી રામનરેશસિંગ ક્ષત્રિય પાસેથી થેલો ઝુંટવી લુંટ કરી નાસી ગયા હતા. થેલામાં રોકડ રૂપિયા ૧,૭૫,૦૦૦/- હતા. આ અંગેની ફરીયાદ રામનરેશસિંગ ક્ષત્રિયએ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.બી.પટેલ ચલાવે છે.

વાહન અકસ્માતમાં મૃત્યુ:-

સમાચાર યાદી નં.૧૩૪૩/૧૯

“કે” વિભાગ ટ્રાફિક પોલીસ સ્ટેશન: પ્રકાશભાઈ બાબુભાઈ ભીલ (રહે.આનંદીપુર ભીલવાસ તિર્થભુમી ટેનામેન્ટ સામે મોની હોતલના ખાયામાં નારોલ) એ “કે” વિભાગ ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૮/૦૮/૧૯ કલાક ૬/૦૦ વાગ્યા પહેલા નારોલ કેદાર કોકસ્પીન નામની કાપડની ફેક્ટરી સામે પ્રકાશભાઈના મોટાભાઈ ગોવિંદભાઈને અજાણ્યા વાહન ચાલકે વાહન પુરઝડપે અને બેદરકારીથી ચલાવી ટક્કર મારતા ગંભીર ઈજાઓ થતા ગોવિંદભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી જી.જે.રાઓલ ચલાવે છે.

વિજ કરંટ લાગતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૧૩૪૪/૧૯

જીઆઈડીસી વટવા: શિવાભાઈ ઉર્ફે રવિભાઈ પાટીલ (ઉ.વ.૨૫) (રહે. હનુમાનપર મહેમદાવાદ ખેડા) તા.૦૮/૦૮/૧૯ કલાક ૧૧/૩૦ વાગ્યાના સુમારે વટવા જીઆઈડીસી ફેઝ-૦૨ શ્રી લક્ષ્મી ઇંડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં લેમીનેશન પ્લાંટનું મશીન પકડી સાઇડમાં મુકવા જતા વિજ કરંટ લાગતા સારવાર માટે એલ.જી.હોસ્પિટલ લઈ જતા ફરજ પરના ડૉશ્રીએ મૃત જાહેર કર્યા હતા. આ અંગે જીઆઈડીસી વટવા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.સી.જાડેજા ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૧૩૪૫/૧૯

માધવપુરા: મહેશભાઈ હીરાલાલ ઠાકર (ઉ.વ.૭૪) (રહે. પંચવાટીકા સોસાયટી સાધના સોસાયટીની બાજુમા શાહીબાગ) એ અગમ્ય કારણસર તા.૦૭/૦૮/૧૯ સવારના ૮/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે એસીડ પી લીધું હતું. સારવાર માટે તેમને મણીનગર સરદાર પટેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૦૮/૦૮/૧૯ કલાક ૬/૪૫ વાગે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે માધવપુરા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી લાલુભાઈ હીરાભાઈ ચલાવે છે.

ઈસનપુર: યોગેશભાઈ સોમાભાઈ પરમાર (ઉ.વ.૪૨) (રહે.શક્તિનગર ચામુંડાનગર વિભાગ-૨ ઈસનપુર) એ અગમ્ય કારણસર તા.૦૮/૦૮/૧૯ કલાક ૭/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખાના હુકમાં રૂમાલ બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ઈસનપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી એન.જે.મારૂ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.